



મારે COVID-19 અળગાપણુ અથવા ક્વોરન્ટીનમાં ક્યાં સુધી રહેવાની જરૂર છે?

નોંધ: સંપૂર્ણ રસીકરણ લક્ષણો વગરના લોકોને પરીક્ષણ કરવાની જરૂર નથી, પરંતુ સંપર્કમાં આવ્યા પછી પણ 14 દિવસ સુધી લક્ષણોની દેખરેખ રાખવી જોઈએ.


જો તમે બીમાર હોય અને COVID-19 નો ટેસ્ટ પોઝિટિવ આવે તો: 10 દિવસ સુધી ઘરમાં રહો અને ઓછામાં ઓછા 24 કલાક તાવ ન આવે અને તમને સારું લાગે ત્યાં સુધી.





જો તમે બીમાર હોય અને COVID-19 માટે ટેસ્ટ નેગેટિવ આવે: 24 કલાક સુધી ઘરમાં રહો અથવા તમારા લક્ષણો જતાં રહે અને તમને સારું થઈ જાય ત્યાં સુધી.



જો તમે બીમાર નથી અને COVID-19 માટે ટેસ્ટ પોઝિટિવ આવે: પરીક્ષણ કર્યા પછી 10 દિવસ ઘરે રહો.



જો તમે બીમાર નથી, પરંતુ COVID-19 કેસ સાથે નજીકનો સંપર્ક ક્યો હતો: 14 દિવસ સુધી ઘરમાં રહો.



જો તમે બીમાર નથી પરંતુ એવી કોઈ વ્યક્તિ સાથે રહો છો જેમને COVID-19 છે તો: ઘરમાં રહો અને 14 દિવસ સુધી બીમારવ્યક્તિથી દૂર રહો. જો તમે COVID-19 વાળી કોઈ વ્યક્તિની સંભાળ રાખી રહ્યા છો, અથવા જો બીમાર વ્યક્તિને ઘરના અન્ય સભ્યોથી અલગ રાખી શકાય તેમ નથી, તમારે બીમાર વ્યક્તિ જ્યાં સુધી ઘરમાં છે ત્યાં સુધી ઘરમાં રહેવું જોઈએ (ઓછામાં ઓછા 10 દિવસ) અને ઉમેરો 14 વધુ દિવસો.



COVID-19 અંગેના સર્વસામાન્ય પ્રશ્નો માટે 211 અથવા 1-800-962-1253 પર કોલ કરો. COVID AlertNJ app ડાઉનલોડ કરો: covid19.nj.gov/app.